

કારણ એક નુકશાની અનેક


ડિસેમ્બર - ૨૦૧૮

એટલાન્ટા, જ્યોર્જ્યામાં આવેલું હર્ટસફીલ્ડ - જેક્સન આંતરરાષ્ટ્રીય વિમાનમથક, વિશ્વનું સૌથી વ્યસ્ત હવાઈમથક છે, જે રોજના લગભગ ૨,૭૫,૦૦૦ મુસાફરોને સેવાઓ આપેછે. ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ના રવીવારે લગભગ બાપોરે ૧.૦૦ વાગ્યે, વર્ષના સૌથી વ્યસ્ત પ્રવાસ સમય દરમિયાન, આગને કારણે વિમાનમથક નો મુખ્ય વિજળી પુરવઠો તથા બેક અપ વિજળી પુરવઠો પણ ખોરવાયો. જેને કારણે આખા વિમાનમથકનો બધોજ વિજળી પુરવઠો બંધ થઈ ગયો જે લગભગ ૧૧ કલાક સુધી બંધ રહ્યો. આ સમયે વિમાનમથકમાં લગભગ ૩૦,૦૦૦ લોકો હાજર હતા. હાંઝો લોકો જમીન પર વિમાનમાં તથા હવામાં વિમાન બીજી જગ્યાએ મોકલવાને કારણે અટવાઈ ગયા, જેમાં અમેરીકન ટ્રાન્સપોર્ટેશન સેકેટરી પણ સામેલ હતાં. બે દિવસમાં ૧૦૦૦થી વધારે ફ્લાઇટો કેન્સલ થઈ આને કારણે આખા અમેરીકાના ફ્લાઇટ ના સમયપત્રક બગડી ગયા. અને એક એરલાઇન ને ૫૦૦ લાખ ડોલરનું નુકશાન થયું.



વિમાનમથકની યુટીલીટી ટનલમાં વિજળીની સ્વીચમાં ખરાબી થવાથી આગ ચાલુ થઈ હતી. વિમાનમથકને વિજળીકંપની દ્વારા જુદા જુદા સબસ્ટેશનમાંથી બે અલગ પાવર સાપ્લાય દ્વારા વિજળી પુરવઠો પુરો પાડવામાં આવતો હતો. પરંતુ બંને વિજળી પુરવઠાના વાયરો એક જ યુટીલીટી ટનલમાં થી પસ્સાર થતાં હતાં જેમાં સ્વીચમાં ખોટકો થયો હતો. આગને કારણે બંને મુખ્ય વિજળી પુરવઠો તથા વૈકલ્પિક વિજળી પુરવઠો ખોરવાયો. આને કહેવાય કારણ એક નુકશાની અનેક. આ કેસમાં સ્વીચમાંથી આગ લાગવી જે એક ઘટના - એક કારણ - જેને કારણે બે અથવા વધારે સાધનોના ભાગો અથવા પ્રણાલીઓ માં ખરાબી ઉત્પન્ન થઈ - વિમાન મથકના મુખ્ય વિજળી પુરવઠામાં અને વૈકલ્પિક વિજળી પુરવઠામાં. પ્રક્રિયા કારખાનામાં પણ રોજંદા કામકાજ અને કટોકટી વખતની પરીસ્થિતિ એમ બંને પરીસ્થિતિમાં એકજ કારણથી વધુ જગ્યાએ ખરાબી થઈ શકે. દા.ત. રીએક્ટરોમાં બે ઉચ્ચા તાપમાનના સેન્સરો બંનેને એક જ ટેકનીશીયન દ્વારા એક સરખી પદ્ધતિ દ્વારા કેલીબ્રેટ કરેલાં હતાં, દુંભાયે ટેકનીશીયન યોગ્ય રીતે તાવીમ પામેલ ન હતો અને બંને સેન્સરોને અયોગ્ય રીતે કેલીબ્રેટ કરેલાં હતાં, જેથી બંને સેન્સરો ખોટા તાપમાન દર્શાવવા લાગ્યા.

૧૮૮૪માં પાઈપર આલ્ફા ની ઉત્તર સમુદ્રીય દુર્ઘટનામાં, દરિયામાં થી પાણી ખેંચતાં અભિનશમનના પાણીના પમ્પોને જાતે ચાલુ બંધ કરતાં હતાં કારણકે મરજીવાઓ દરિયામાં પ્લટેર્ફોર્મની આજુબાજુ જ હતાં. પ્લટેર્ફોર્મ ઉપર છુટેલો ગેસ સળગ્યો, જેનાથી આગ ચાલુ થઈ, અને આગને કારણે અભિનશમનના પાણીના પમ્પોની સ્વીચો ચાલુ કરવા સુધી પહોંચી શકાયું નહીં. આગ એક કારણ હતું - જેણે આગ માટે પાણી ની જરૂરીયાત ઉલ્લી કરી અને અભિનશમનના પાણીના પમ્પોની સ્વીચ સુધી પહોંચવા માટે અવરોધ ઊભો કર્યો. બીજી એવી કોઈ જગ્યા ન હતી જ્યાંથી અભિનશમનના પાણીના પમ્પો ચાલુ કરી શકાય.



તમો શું કરી શકો ?

- તમારાં પ્લાન્ટમાં રોજંદા કામકાજમાં અને કટોકટી વખતની પરીસ્થિતિ અને પદ્ધતિ એમ બંને સ્થિતિમાં ખોટકો ઊભા થવાના અને કારણો શોધો જે એકથી વધારે પ્રણાલીને ખોટકાવી શકે (ખાસ કરીને પ્રાથમિક પ્રણાલી અને તેની વૈકલ્પિક પ્રણાલી).
- જાયારે તમે કટોકટી નું રીહસ્કલ માં સામેલ હોવ ત્યારે ખોટકો ઊભા થાય એવા કારણ એક નુકશાની અનેક થઈ શકે છે તે શોધો - એવી વસ્તુજે કટોકટી ઉત્પન્ન કરે અને તમને કટોકટી સામે લડવાની પદ્ધતિ અથવા કટોકટી ને સામનો કરવાના સાધનો વાપરવા સામે પણ તમને રોકે. ઉદાહરણ તરીકે રાતે વિજળી જતી રહે અને તમારે કટોકટી માટે જનરેટર ચાલુ હોય ત્યારે વિજળી જતી રહી હોવાથી સું તંતે જનરેટર ચાલુ કરવા માટે બરોખર જોઈ શકશો ?
- સુરક્ષા વ્યવસ્થાઓ અને બેકઅપ સુરક્ષા સાધનોને ખૂબ ધ્યાનથી જુઓ અને સંભવિત નિષ્ફળતાના કારણ એક નુકશાની અનેકને ગણતરીમાં લો. ખાસ કરીને, જો પ્રાથમિક અને બેકઅપ વ્યવસ્થા એક જ રૂમમાં રાખવામાં આવેલ હોય અથવા એકબીજાની સાથે રાખેલ હોય, તો પ્રાથમિક અને બેકઅપ બંને વ્યવસ્થા ને કામ કરવા અસમર્થ કરતી આગ, પુર અથવા અચ્ય ખાસ અગત્યની ઘટનાની સંભાવનાને ધ્યાનમાં લો.
- કારણ એક નુકશાની અનેક ના નિસબ્ત ની જગ્યા તમારા વ્યવસ્થાપન અને ઈજનેરી કર્મચારીઓને કરો, તેથી તેઓ કારણ એક નુકશાની અનેક જેવી પરિસ્થિતિઓને દુર કરવા પગલાંનું મુલ્યાંકન કરી શકે.

કારણ એક નુકશાની અનેક ને રોજંદી કામગીરી અને કટોકટી પ્રતિક્રિયા માં શોધો !

©AIChE 2018. All rights reserved. Reproduction for non-commercial, educational purposes is encouraged. However, reproduction for any commercial purpose without express written consent of AIChE is strictly prohibited. Contact us at ccps_beacon@aiche.org or 646-495-1371.